



SEC/1102/2026

**By e-Filing**

February 11, 2026

National Stock Exchange of India Limited "Exchange Plaza", C-1, Block G, Bandra- Kurla Complex, Bandra (E), Mumbai – 400 051. <b>Scrip Symbol : APARINDS</b> <b>Kind Attn.: Listing Department</b>	BSE Limited Corporate Relationship Department, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai – 400 001. <b>Scrip Code : 532259</b> <b>Kind Attn. : Corporate Relationship Department</b>
---	---

**Sub. : Disclosure under Regulation 30 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 - Newspaper advertisement -  
Notice of Postal Ballot dtd. January 29, 2026**

Dear Sir / Madam,

In continuation with our letter no. SEC/1002/2026 dated February 10, 2026 w.r.t submission of Postal Ballot Notice dated January 29, 2026 ("**the Notice**") seeking approval of the Shareholders, we are now sending herewith the copies of newspaper advertisements published in editions of Business Standard (English language newspaper) and Vadodara Samachar (Vernacular language newspaper) on February 11, 2026, with respect to completion of dispatch of Notice to the Shareholders of the Company.

The advertisements may also be accessed on the website of the Company at [www.apar.com](http://www.apar.com).

You are requested to take the same on record.

Thanking you,

Yours faithfully,

**For APAR Industries Limited**

**(Sanjaya Kunder)**  
**Company Secretary**

**Encl.:** As above

APAR Industries Limited

Corporate Office : **APAR House, Corporate Park, V. N. Purav Marg, Chembur, Mumbai - 400 071, India**

**+91 22 6780 0400 / 49572100 corporate@apar.com www.apar.com**

Regd. Office: **301/306, Panorama Complex, R. C. Dutt Road, Alkapuri, Vadodara - 390007, India**

**+91 265 6178 700/6178 709 apar.baroda@apar.com www.apar.com CIN: L91110GJ1989PLC012802**

# Dixon’s valuation factors in multiple headwinds

Brokerages have mixed views on performance of EMS major

RAM PRASAD SAHU
Mumbai, 10 February

Despite multiple concerns related to a muted performance in the December quarter, higher input costs and uncertainty related to the Vivo joint venture, the stock of electronic manufacturing services major Dixon Technologies (India) is up 13 per cent since the start of February.

Prior to the rally this week, the stock had shed over 33 per cent from its highs in November 2025. After the Q3 results and a correction in the price, some brokerages have upgraded the stock.

Sales growth in the December quarter was just 2 per cent year-on-year (Y-o-Y) and, adjusted for the lighting segment growth 4 per cent.

Consumer electronics sales fell 10 per cent over the year-ago quarter due to a slowdown after the festival season.

While home appliances grew 13 per cent Y-o-Y on healthy demand for washing machines, the company’s largest segment of mobile phones, with a growth of 5 per cent, saw the lowest rate in the past 16 quarters.


Motilal Oswal Research believes that the current demand slowdown is transient for next few quarters and is not a demand destruction issue.

Analysts led by Teena Virmani of the brokerage believe that the current market price is already factoring in the worst-case scenario of continued weakness in base smartphone volumes, only one client addition in mobile where discussions are underway, and no volume addition from Vivo over FY26-28. They have a buy rating with an unchanged target price of ₹16,700.

During the quarter, the company posted volume of 6.9 million smartphones and expects 7-7.5 million smartphones in Q4. This



## Stock shock



could amount to 34 million smartphones in FY26, lower than annual guidance of 40-42 million announced in Q2, points out Elara Securities.

Analysts led by Harshit Kapadia of the brokerage say that the outlook remains clouded for mobile volumes. This is on account of the delay in approval of Vivo & HKC joint ventures (JVs) and surging memory module prices, dragging down low-end mobile volumes.

The brokerage has cut its earnings for FY26 by 12 per cent while the cuts for FY27 and FY28 earnings were 19 per cent and 22 per

cent, respectively. This is based on the delay in approval of the Vivo & HKC JV and lower volume of low-end phones, due to rising memory prices.

The analysts, have, however, reiterated their accumulate rating due to the production-linked incentive (PLI) scheme in components and a strong pickup in the non-mobile segments, which may offer respite to earnings volatility. The brokerage has a target price of ₹12,000.

Nomura Research has also lowered its mobile volume estimates to 34 million for FY26 while its estimates for FY27 and FY28 are down by 2 million and 3 million units, respectively. This is partly offset by strong traction in the IT hardware segment. While near-term growth will remain soft, analysts led by Siddhartha Bera expect a stronger ramp up from FY27 on new customer additions and from investments on component manufacturing. This will start contributing from H2FY27. Any PLI extension announcement by the government poses upside risk to their estimates. The brokerage lowered operating and net profit estimates by 6-11 per cent over FY26-28. It has a buy rating with a target price of ₹14,678.



## DEFINITION OF A CONSUMER UNDER LAW

# Courts focus on dominant objective to determine status

SANJEEV SINHA

The Supreme Court has emphasised in a recent case that buying immovable property, even multiple units, does not automatically make the buyer a “commercial” investor or strip them of protection under the Consumer Protection Act. The judgment has far-reaching implications for consumers.

### Who is a consumer?

Under the Consumer Protection Act, 2019, a consumer is a person who buys goods or avails services for a consideration, whether paid fully, partly, or on deferred terms. “The definition also covers users and beneficiaries, so long as such use is with the buyer’s approval. However, purchases made for resale or for a ‘commercial purpose’ are excluded,” says Vishal Gehrana, partner designate, Karanjawala & Co.

Mere ownership, investment, or even the purchase of multiple units does not amount to commercial purpose. There must be clear evidence that profit-making

was the dominant objective.

### Self-employment exception

The law makes an exception for goods or services used for self-employment or to earn a livelihood. Even if the buyer generates an income using purchased goods or services, the law does not treat the transaction as commercial if the individual uses them personally for their own work.

“Initially, the service provider must show that the transaction was commercial. The burden then shifts to the complainant to establish that the self-employment exception applies. Courts examine the substance of the activity, not labels. Where the goods or services are used directly to earn a livelihood, without a larger commercial enterprise, the complainant remains a consumer,” says Gehrana.

### Grey areas used to deny consumer status

Goods and service providers often invoke commercial purpose. They argue that when goods or services

are used for profit generation and in the regular course of business, the complainant cannot claim consumer status.

“Insurers and developers often contend that high-value insurance policies or purchases of commercial property reflect a dominant profit motive and fall outside consumer protection,” says Tannya Baranwal, partner, IndiaLaw.

### How courts determine commercial purpose

Courts and consumer commissions apply the dominant purpose test to decide whether a transaction is commercial.

Baranwal says the Supreme Court laid down this principle in *Laxmi Engineering Works vs. PSG Industrial Institute*, holding that the decisive factor is whether the goods or services have a direct nexus with profit-oriented commercial activity. “The determination is fact-specific and cannot rest solely on the value of the goods or the buyer’s business profile,” says Baranwal.

### Handling objections

Consumers should address the point regarding their consumer status upfront. They should state

## Proving residential purpose

- Show buyer agreement describing the unit as residential
- Personal home loan records
- Communications showing housing or family needs
- Follow-ups for possession

the purpose of the purchase clearly, and confirm it was not for business use. In case of a real estate purchase, they should explain any leasing, if done later. They should also file key documents — such as agreements, payment records, and loan papers — early.

“Later renting of the property does not automatically make the purchase commercial. The key issue is whether there was an intention, from the outset, to engage in commercial leasing as a business. Buyers should clearly state their intent and avoid loosely labelling the purchase as an ‘investment’, which may be misconstrued,” says Shankey Agrawal, partner, BMR Legal.

The burden of proving commercial purpose lies on the firm. “If the company cannot show clear evidence linking the transaction to a business activity, the objection is likely to fail,” says Agrawal.

### Points to remember

When goods and service providers question their status as consumers, the latter should respond with consistency: statements in the complaint should align with their bank records, tax treatment, and other documents.

“Courts generally take a practical view and are cautious about rejecting genuine complaints on technical grounds. Proper records and a coherent narrative often make the decisive difference,” says Agrawal. Finally, remember that consumer law aims to protect individuals acting in good faith, not provide an escape route to goods and services providers.

The writer is a New Delhi-based independent journalist

COMPILED BY SUNAINAA CHADHA

## Provident fund withdrawal through UPI? EPFO to launch new app in April

If you have an Employees’ Provident Fund (EPF) account, withdrawing money could soon become much faster and simpler. The Employees’ Provident Fund Organisation (EPFO) is preparing to launch a new mobile application in April that will allow subscribers to withdraw eligible EPF funds directly into their bank accounts using the UPI payment gateway.

Read full report here: mybs.in/2g3oXMF

### What could change for EPF subscribers?

- With the proposed system, subscribers may be able to:
- View their withdrawable EPF balance in the new mobile app
  - Transfer eligible funds directly to their linked bank account
  - Authenticate the transaction using a UPI PIN
  - This could significantly reduce

the time and effort required to access EPF savings.


### Trials underway

The EPFO is currently testing the system using dummy accounts to identify and fix technical issues before the official rollout. The new app is expected to complement — not replace — existing platforms like the UAN portal

and UMANG app.

### Faster access to emergency funds

The limit for auto-settlement has been increased to ₹5 lakh, enabling quicker access to funds for various purposes, including medical emergencies and education.



# KILBURN ENGINEERING LTD.

Registered Office : Unit No.1901, 19th Floor, Biowonder - Block 'A', 789 Anandapur E.K.T, Kolkata -700 017  
CIN: L24232WB1987PLC042956, Website: www.kilburnengg.com


### EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31 DECEMBER 2025 (₹ in Lakhs)

Sr. No.	PARTICULARS	QUARTER ENDED	QUARTER ENDED	QUARTER ENDED	9 MONTHS ENDED	9 MONTHS ENDED	YEAR ENDED
		UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	AUDITED
		31.12.2025	30.09.2025	31.12.2024	31.12.2025	31.12.2024	31.03.2025
1	Total Income	10,717.09	11,686.34	9,176.57	32,081.45	23,483.70	33,800.02
2	Profit / (Loss) before Tax	2,138.31	2,588.33	1,815.36	6,846.68	4,871.30	7,350.90
3	Net Profit/ (Loss) after Tax	1,489.85	1,801.14	1,401.87	4,762.28	3,856.36	5,481.64
4	Total Comprehensive Income / (Loss) for the period/ year	1,328.51	1,971.21	1,223.17	4,795.91	4,013.95	5,360.67
5	Paid-up equity share capital (Face Value ₹ 10 each)	5,188.79	5,143.79	4,748.79	5,188.79	4,748.79	4,748.79
6	Earnings Per Share (EPS) (in ₹)						
	Basic and Diluted EPS (in ₹)	2.98	3.65	3.19	9.51	8.79	12.24

### EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31 DECEMBER 2025 (₹ in Lakhs)

Sr. No.	PARTICULARS	QUARTER ENDED	QUARTER ENDED	QUARTER ENDED	9 MONTHS ENDED	9 MONTHS ENDED	YEAR ENDED
		UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	AUDITED
		31.12.2025	30.09.2025	31.12.2024	31.12.2025	31.12.2024	31.03.2025
1	Total Income	15,892.73	15,721.14	10,942.00	44,791.26	29,981.77	42,761.91
2	Profit / (Loss) before Tax	3,199.91	3,742.41	1,950.56	9,906.94	5,325.04	8,266.47
3	Net Profit/ (Loss) after Tax	2,315.68	2,688.29	1,517.07	7,134.68	4,197.84	6,229.41
4	Total Comprehensive Income / (Loss) for the period/year	2,147.73	2,852.07	1,339.22	7,147.62	4,348.93	6,093.51
5	Paid-up equity share capital (Face Value ₹ 10 each)	5,188.79	5,143.79	4,748.79	5,188.79	4,748.79	4,748.79
6	Earnings Per Share (EPS) (in ₹)						
	Basic and Diluted EPS (in ₹)	4.63	5.45	3.46	14.25	9.57	13.94

**Notes:**  
The above is an extract of of the detailed format of Statement of Unaudited Standalone and Consolidated Financial Results for the quarter and nine months ended 31 December 2025 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of Unaudited Financial Results is available on the Stock Exchange websites and on the Company's website [www.kilburnengg.com](http://www.kilburnengg.com). The same can be accessed by scanning the QR code provided below.



**Date : 10th February, 2026**  
**Place : Kolkata**

**By Order of the Board**  
**(Ranjit Lala)**  
**Managing Director**  
**DIN 07266678**



## APAR Industries Limited

(CIN : L91110GJ1989PLC012802)

Registered Office : 301, Panorama Complex, R. C. Dutt Road, Vadodara - 390 007, (Gujarat), India.  
Tele. No. : (+91) (265) 6178740, 2339906 E-mail : [com.sec@apar.com](mailto:com.sec@apar.com) Website : [www.apar.com](http://www.apar.com)

### POSTAL BALLOT NOTICE TO MEMBERS

The Members of APAR Industries Limited (“the Company”) are hereby informed that pursuant to the provisions of Section 108 read with Section 110 and all other applicable provisions, if any, of the Companies Act, 2013 (“the Act”) read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, the relevant General Circulars issued by the Ministry of Corporate Affairs, Government of India (“MCA Circulars”) from time to time resting with General Circular no. 03/2025 dated September 22, 2025, Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (“SEBI Listing Regulations”), Secretarial Standard - SS-2 on General Meetings issued by the Institute of Company Secretaries of India and subject to any other applicable law, rules, and regulations (including any statutory modification(s) or re-enactment(s) thereof, for the time being in force), the Company seeks the approval of the Members through Postal Ballot for the Special Business by way of a Special Resolution, as set out in the Postal Ballot Notice dated January 29, 2026 along with the Explanatory Statement (“the Notice”), by way of electronic means (i.e. remote e-voting) only.

The dispatch of Notice through email has been completed on Tuesday, February 10, 2026 to those members whose names appear in the Register of Members / List of Beneficial Owners as received from the National Securities Depositories Limited (“NSDL”) and Central Depository Services (India) Limited (“CDSL”) as on Friday, February 6, 2026 (“Cut-off Date”) and who have registered their email address with the Company / RTA / Depositories. Physical copies of the Notice along with Postal Ballot forms and pre-paid business reply envelopes are not being sent to the Members for this Postal Ballot in line with the exemption provided in the MCA Circulars. Accordingly, the Shareholders are required to communicate their assent or dissent through the remote e-voting system only.

The Notice along with the instructions for remote e-voting is also available on the Company's website at [www.apar.com](http://www.apar.com) and the website of CDSL i.e. [www.evotingindia.com](http://www.evotingindia.com) and at the relevant sections of the websites of BSE Limited (“BSE”) and National Stock Exchange of India Limited (“NSEIL”), the Stock Exchanges, on which the shares of the Company are listed i.e. [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) respectively. Shareholders who have not received the Postal Ballot Notice may download the same from the above mentioned websites.

Members holding shares in dematerialized mode, who have not registered / updated their email addresses / Bank Account Details with their Depository Participants (“DPs”) are requested to register / update the same with the DPs with whom they maintain their demat accounts and Members holding shares in physical mode, who have not registered / updated their email addresses / Bank Account details with the Company are requested to register / update the same with the Company by sending an e-mail at [investor.helpdesk@in.mprms.mufg.com](mailto:investor.helpdesk@in.mprms.mufg.com) by quoting their Folio Number and attaching duly filled in and signed Form ISR-1 along with annexures thereof in order to facilitate the Company to serve the documents through the electronic mode.

The Company has appointed CDSL for facilitating remote e-voting to enable the Shareholders to cast their votes electronically. Voting Rights shall be reckoned on the basis of paid-up value of shares registered in the name of the Member(s) as on the Cut-off date and any person who is not a member as on that date should treat the Notice for information purposes only.

The facility to exercise vote on Notice by remote e-voting, will be available for the following period :

Commencement of e-voting	: From 10:00 Hrs on Friday, February 13, 2026
End of e-voting	: To 17:00 Hrs on Saturday, March 14, 2026

During this period, members of the Company holding equity shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e., Friday, February 6, 2026 shall cast their vote electronically. E-voting shall not be allowed after 17:00 Hrs. on Saturday, March 14, 2026. The e-voting module shall be disabled by CDSL for e-voting thereafter.

The results of the Postal Ballot / E-voting shall be declared within two (2) working days from the conclusion of remote e-voting and the same, along with the Scrutinizer's Report, will be placed on the website of the Company and will also be communicated to the Stock Exchanges and CDSL.

If you have any queries or issues regarding e-Voting from the CDSL e-Voting System, you can write an email to [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) or contact at 1800 21 099 11.

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, AVP, Central Depository Services (India) Limited, 'A' Wing, 25<sup>th</sup> Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N. M. Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) or call at toll free no. 1800 21 099 11.

**By order of the Board**  
**For APAR Industries Limited**  
**Sd/-**  
**Sanjaya Kunder**  
**Company Secretary**

**Place : Mumbai**  
**Date : February 10, 2026**



## દિકિટ લઈ આવો જીતાડી દર્શશ', વાવ થરાદમાં ભુવાએ નેતાને ધારાસભ્ય બનાવાની ભવિષ્યવાણી કરી

● પાલનપુર, તા. ૧૦

થરાદ તાલુકાના ડુવા ગામે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ભુવાએ કરેલી ભવિષ્યવાણી હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ઉલ્લેખનીય છે કે માંગીલાલ પટેલ કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે અને તેઓ વર્તમાન સાંસદ ગેનીબેન ઠાકોરના નજીકના માનવામાં આવે છે.

કાર્યક્રમમાં હાજર લોકો સામે ભુવાએ કહ્યું હતું કે, “૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં દિકિટ લઈને આવજો, હું તમને ૧૧,૦૦૦ મતથી જીતાડિશ.ગોગા મહારાજના ભગત ગોદાભાઈનું ડુવા ગામે રમેલમાં નિવેદન સામે આવ્યું છે. અને ઘણા બધા લોકો રમેલમાં આવે છે અને માંગીલાલના ચાહકો પણ આયા હતા જેમાં ચાહકોએ કીધું કે આવનારી ૨૦૨૭ની ચૂંટણીમાં માંગીલાલ જીતશે કે કેમ તો ગોગા મહારાજને પૂછ્યું તો ગોગા મહારાજને કીધું કે દિકિટ મળશે તો માંગીલાલ જીતશે અને ૧૧ હજાર વોટો જીતશે એવુ છે ગોગા મહારાજે કીધું.

ભુવાએ આગળ કહ્યું કે જો તેઓ માંગીલાલ પટેલને જીતાડવામાં નિષ્ફળ જાય તો પોતાને “મહારાજ” ન કહેવા માટે પણ જણાવ્યું હતું. ભુવાની આ વાતો કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ચર્ચા જગાવતી બની હતી. હું તમને ૧૧,૦૦૦ મતથી જીતાડિશ.ગોગા મહારાજના ભગત ગોદાભાઈનું ડુવા ગામે રમેલમાં નિવેદન સામે આવ્યું છે. અને ઘણા બધા લોકો રમેલમાં આવે

છે અને માંગીલાલના ચાહકો પણ આયા હતા જેમાં ચાહકોએ કીધું કે આવનારી ૨૦૨૭ની ચૂંટણીમાં માંગીલાલ જીતશે કે કેમ તો ગોગા મહારાજને પૂછ્યું તો ગોગા મહારાજને કીધું કે દિકિટ મળશે તો માંગીલાલ જીતશે અને ૧૧ હજાર વોટો જીતશે એવુ છે ગોગા મહારાજે કીધું.

ઉલ્લેખનીય છે કે માંગીલાલ પટેલ કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે અને તેઓ વર્તમાન સાંસદ ગેનીબેન ઠાકોરના નજીકના માનવામાં આવે છે.

ભુવાએ માંગીલાલ પટેલને ધારાસભ્ય બનવાની સ્પષ્ટ ભવિષ્યવાણી કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. ગોગા મહારાજના ભગત ગોદાભાઈનું ડુવા ગામે રમેલમાં નિવેદન સામે આવ્યું છે. અને ઘણા બધા લોકો રમેલમાં આવે છે અને માંગીલાલના ચાહકો પણ આયા હતા જેમાં ચાહકોએ કીધું કે આવનારી ૨૦૨૭ની ચૂંટણીમાં માંગીલાલ જીતશે કે કેમ તો ગોગા મહારાજને પૂછ્યું તો ગોગા મહારાજને કીધું કે દિકિટ મળશે તો માંગીલાલ જીતશે અને ૧૧ હજાર વોટો જીતશે એવુ છે આ સમગ્ર મામલે માંગીલાલ પટેલે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, “ભુવાએ જે કંઈ કહ્યું છે તે એમનો અંગત વિષય છે.”ભુવાની આ ભવિષ્યવાણી બાદ થરાદ સહિત આસપાસના વિસ્તારોમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે, જ્યારે આવનારી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે.

## ગીરનાર પર્વત પર મહાશિવરાત્રી પહેલા જ જૈન સંપ્રદાયની ધ્વજ ફરકાવતા વિવાદ ફરી વર્ચ્યો, સંતોમાં ભારે રોષ

● જૂનાગઢ, તા. ૧૦

જૂનાગઢમાં ભવનાથમાં હાલ મહાશિવરાત્રીના મેળાની તડામઠ તેયારી ચાલી રહી છે. મહાશિવરાત્રીના મહામેળાને આડ બસ હવે ગણતરીના દિવસો રહ્યા છે અને પહેલા જ ગિરનાર પર્વત પરના શિખરોની માલિકીનો વિવાદ ફરી સામે આવ્યો છે. ગિરનાર પર્વત પર જૈન સંપ્રદાયની ધ્વજ ફરકાવતા સાધુ સંતોમાં રોષ ફેલાયો છે અને ધ્વજ ફરકાવનારા બે લોકો વિરુદ્ધ એકઠાઈઆર નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે ગોરબનાથ ટ્રસ્ટના મહંત સોમનાથગીરી બાપુએ ફરિયાદ નોંધાવી છે. જેમા જૈન અનુયાયીઓ દ્વારા ઓધડ શિખર પર અનઅધિકૃત હક સ્થાપિત કરવાનો આરોપ લગાવ્યો છે. થોડા દિવસ પહેલા ગોરબનાથ અને દત્તાત્રેય ટ્રસ્ટ વચ્ચે આવેલા ઓધડ ટ્રસ્ટ

પર જૈન ધર્મની ધ્વજ ફરકાવાઈ હતી અને સુત્રોચ્ચાર કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે ઓધડ શિખર પ્રત્યે નાથ સંપ્રદાયની વિશેષ આસ્થા જોડાયેલી છે. આ જગ્યા ગોરબનાથજીના દલિયાની જગ્યા હેઠળ રજીસ્ટર છે. ત્યારે નાથ સંપ્રદાયના સંતોમાં આ ઘટનાથી ભારે રોષ જોવા મળ્યો. અને તેમણે આ કૃત્યને સનાતન પરંપરા પર તરાપ ગણાવી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. થોડા દિવસ પહેલા ગોરબનાથ અને દત્તાત્રેય ટ્રસ્ટ વચ્ચે આવેલા ઓધડ ટ્રસ્ટ પર જૈન ધર્મની ધ્વજ ફરકાવાઈ હતી અને સુત્રોચ્ચાર કરાયા હતા.

સમગ્ર મામલે હવે ધ્વજ ફરકાવનારા બે લોકો વિરુદ્ધ એકઠાઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે સો. મીડિયા ક્રૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

## રાજકોટમાં સીજીએસટીનો કર્મચારી કંપનીના વેરિફિકેશન માટે પ હજારની લાંચ લેતા ઝડપાયો

● રાજકોટ, તા. ૧૦

કંપનીના વેરિફિકેશન માટે એક વ્યક્તિ પાસેથી રૂ.૫,૦૦૦ની લાંચ લેતા રાજકોટ મિનિસ્ટ્રી ઓફ

ફાઈનાન્સ, વર્ગ-૨, સીજીએસટીમાં ફરજ બજાવતા ધર્મેન્દ્ર સરથુપ્રસાદ યાદવની એસીબીએ ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ

ફરિયાદીએ તેમના ભાગીદાર સાથે બીગપોર્ટ એક્સપોર્ટ ઈમ્પોર્ટ નામની કંપની ખોલી હતી. જે કંપનીના વેરિફિકેશન માટે આરોપી ધર્મેન્દ્ર યાદવ

કંપનીના સરનામા પર ગયો હતો.. જે અંગે ફાઈનલ રિપોર્ટ આપવા માટે ફરિયાદી

પાસે રૂપિયા ૫,૦૦૦ ની માંગણી તા.૦૮.૦૨.૨૦૨૬ના રોજ આપવાનું કરી હતી. આ રકમ આરોપીને કહ્યું હતું.



### ભારત પેરેન્ટર્સ લિમિટેડ

Corporate Identity Number (CIN): L24231GJ1992PLC018273

રજિસ્ટર્ડ અને કોર્પોરેટ ઓફિસ: સર્વેનંબર ૧૪૪-એ, જરોદ-સમલાથા રોડ, વિલ. હરીપુરા, તા. સાવલી, વડોદરા-૩૮૧૫૨૦, ગુજરાત, ભારત. સંપર્ક નંબર: +૯૧ ૮૯૦૯૮૨૩૩૨ ઈમેલ: cs@bplindia.in વેબસાઈટ: www.bplindia.in

#### નોટીસ

ફીઝીકલ (ભૌતિક) શેરધારકોને સૂચના - ભૌતિક શેરના ટ્રાન્સફર ડીક્લ્સના ફક્ત પુનઃ નોંધણી માટે ખાસ વિન્ડો

સેબીના પરિપત્ર ક્રમાંક HO/38/13/11(2)2026MIRSDPOD/II/3750/2026 તારીખ ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ અનુસાર, સેબીએ ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધીના એક વર્ષના સમયગાળા માટે એક ખાસ વિન્ડો ખોલવાનો નિર્દેશ લીધો છે જેથી ફક્ત ભૌતિક શેરધારકો દ્વારા ટ્રાન્સફર ડીક્લ ફરીથી દાખલ કરી શકાય જે ૦૧એપ્રિલ, ૨૦૧૮ની અંતિમ તારીખ પહેલાં દાખલ કરવામાં આવ્યા હતા અને દસ્તાવેજોમાં ખામીઓન કારણે નકારવામાં આવ્યા હતા/પાછું મોકલવામાં આવ્યા હતા. ૦૧ એપ્રિલ, ૨૦૧૮ની અંતિમ તારીખ પછી ફાઇલ કરવામાં આવેલા અને કંપની દ્વારા નકારવામાં આવેલા કોઈપણ ટ્રાન્સફર ડીક્લ કંપની દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.

તદનુસાર, સેબીના પરિપત્રના પાલનમાં, ભારત પેરેન્ટર્સ લિમિટેડના પાત્ર ભૌતિક શેરધારકોને ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ અથવા તે પહેલાં શેરના ટ્રાન્સફર માટે શેર ટ્રાન્સફર ડીક્લ ફરીથી લોજ કરવા માટે સૂચના આપવામાં આવે છે અને ટ્રાન્સફર માટે ફરીથી લોજ કરાવેલ શેર સેબી દ્વારા નિર્ધારિત યોગ્ય પ્રક્રિયાને અનુસરી જ ડિમીટરિયલાઈઝ્ડ સ્વરૂપમાં પ્રક્રિયા કરવામાં આવશે.


યોગ્ય શેર ધારકો જરૂરી દસ્તાવેજો સાથે તેમની ટ્રાન્સફર વિનંતીઓ કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ (R&TA) ને એફ્રોઈટ કોર્પોરેટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, ૧૮-૨૦, જાકરભોચ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પહેલોમાળ, મકવાણા રોડ, મરોલ નાકા, અંધેરી પૂર્વ, મુંબઈ, મહારાષ્ટ્ર- ૪૦૦૦૫૮ પર અથવા info@adroitcorporate.com પર ઈ-મેલ મોકલી શકે છે.

#### ભારત પેરેન્ટર્સ લિમિટેડ વતી

સહી/-શર્મિલ સોની

કંપની સેક્રેટરી

ICSI M No.ACS-75694



GRAND MERCURE  
SURYA PALACE

JINDAL HOTELS LIMITED

(CIN No.: L18119GJ1984PLC006922)

Registered Office : Grand Mercure Vadodara Surya Palace, Sayajigunj, Vadodara - 390 020.

Tel : 0265 - 2363366 Fax : 0265 - 2363388 Email : share@suryapalace.com Website : www.suryapalace.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31.12.2025

(₹ in Lacs)


Particulars	For the Quarter ended 31.12.2025	For the Nine Months ended 31.12.2025	For the Quarter ended 31.12.2024
1 Revenue from Operations	1,448.82	3,361.06	1,422.73
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	185.93	138.36	292.51
3 Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items)	96.46	48.89	292.51
4 Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items)	64.91	29.29	240.33
5 Total Comprehensive Income for the period [comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	65.77	31.88	240.68
6 Equity Share Capital	700.00	700.00	700.00
7 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	—	—	—
8 Earnings per share (of ₹ 10/- each) Basic & Diluted (Rs.)	0.93	0.42	3.43

Notes : 1. The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results is available on the Company's website at <https://www.suryapalace.com/investors- relations/financial-results/Unaudited-Financial-Results-December-2024.pdf> and the Stock Exchange's Website at [www.bseindia.com](http://www.bseindia.com).

2. The same can be accessed by scanning the QR code provided below :

Date : 10th February, 2026

Place : Vadodara



For JINDAL HOTELS LIMITED

Piyush D. Shah

Managing Director

DIN : 00010884

**અપાર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ**  
(CIN : L91110GJ1989PLC012802)  
રજીસ્ટર્ડ ઓફિસ : ૩૦૧, પેનોરમા કોમ્પ્લેક્સ, આર. સી. દત્ત રોડ, વડોદરા - ૩૬૦ ૦૦૭, (ગુજરાત), ઇન્ડિયા.  
Tele. No.: (+૯૧) (૨૬૫) ૬૧૭૮૭૪૦, ૨૩૩૯૮૦૬ E-mail : com.sec@apar.com Website : www.apar.com

**પોર્ટલ બેલેટ માટેની સભ્યોને સૂચના**

અપાર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ("ધી કંપની") ના સભ્યોને આથી જાણ કરવામાં આવે છે કે કંપની અધિનિયમ, ૨૦૧૩ ("અધિનિયમ") ની કલમ ૧૧૦ને કલમ ૧૦૮ની સાથે વાંચતા અને અન્ય લાગુ પડતી તમામ જોગવાઈઓ, જો કોઈ હોય તો, તદુપરાંત કંપનીના (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) ના નિયમો, ૨૦૧૪ ના નિયમો ૨૦, ૨૨ અનુસાર તથા તેમાં વળતો વળત સુધારો કરાયેલા નિયમો અનુસાર, તદુપરાંત મંત્રાલય કોર્પોરેટ અફેર્સ, ભારત સરકાર દ્વારા જારી કરાયેલા સામાન્ય પરિપત્ર ક્રમાંક ૦૩/૨૦૨૫ તારીખ ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૫ તથા તેની સાથે વળતો વળતના બાકી રહેલા પરિપત્રો ("એમસીએ પરિપત્રો"), સિક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લીસ્ટીંગ ઓટિવલેગેશન અને ડિસ્ક્લોઝર જરૂરિયાતો) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ (સેબી લીસ્ટીંગ રેગ્યુલેશન્સ) ના વિનિયમ ૪૪, ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ જનરલ મીટીંગ્સ પર સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ્સ-૨ ("એસએસ-૨") અને કોઈપણ અન્ય લાગુ કાયદા, નિયમો અને વિનિયમો (કોઈપણ યૈદ્યાનિક ફેરફાર સહિત) અથવા તેના પુનઃઅધિનિયમ(ઓ), કે જે હાલના સમય માટે અમલમાં છે તે અનુસાર કંપની પોર્ટલ બેલેટના માધ્યમથી સ્પષ્ટીકરણ નિવેદન સાથેની તારીખ ૨૯મી જાન્યુઆરી, ૨૦૨૬ ની પોર્ટલ બેલેટની નોટિસમાં દર્શાવેલ વિશેષ વ્યવસાયના વિશેષ ઠરાવ ("ધી નોટીસ") માટે સભ્યોની મંજૂરી માત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમથી (એટલે કે રિમોટ ઈ-વોટીંગથી) મેળવવા માગે છે.

નોટિસ મોકલવાની પ્રક્રિયા મંગળવાર, તારીખ ૧૦મી ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ પૂર્ણ કરવામાં આવી છે અને તે સભ્યોને મોકલવામાં આવી છે કે જેમના નામ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ("એનએસડીએલ") અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ ("સીડીએસએલ") માંથી પ્રાપ્ત થયેલા સભ્યોના રજીસ્ટર / લાભદારી માલિકોની સૂચિ પર શુક્રવાર, તારીખ ૬મી ફેબ્રુઆરી, ૨૦૨૬ (કટ-ઓફ તારીખ) ના રોજ દેખાય છે અને જેમણે કંપની / ડિપોઝિટરીઝ સાથે તેમના ઈ-મેઇલ સરનામાં રજીસ્ટર કર્યા છે. પોર્ટલ બેલેટ નોટિસની ભૌતિક નકલો પોર્ટલ બેલેટ ફોર્મ્સ અને પ્રિ-પ્રોઇડ બિઝનેસ રિપ્લાય એનલપ્સ સાથે આ પોર્ટલ બેલેટ માટે સભ્યોને એમસીએ પરિપત્રોમાં આપવામાં આવેલી મુદ્દિને અનુસર મોકલવામાં આવી રહી નથી. તેથી શેરધારકોએ તેમની સંમતિ અથવા અસંમતિ માત્ર રીમોટ ઈ-વોટીંગ પદ્ધતિથી જ વ્યક્ત કરવાની છે.

રિમોટ ઈ-વોટિંગ માટેના નિર્દેશો સાથેની આ નોટિસ કંપનીની વેબસાઈટ [www.apar.com](http://www.apar.com) પર અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ ("સીડીએસએલ")ની વેબસાઈટ [www.evotingindia.com](http://www.evotingindia.com) પર અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ ("બીએસએલ") અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ ("એનએસએલએક્સ")ની વેબસાઈટના સુસંગત વિભાગો, કે જેના પર કંપનીના શેર લિસ્ટેડ છે એટલે કે કમ્પ્રા: [www.bseindia.com](http://www.bseindia.com) અને [www.nseindia.com](http://www.nseindia.com) પર પણ ઉપલબ્ધ છે. જે શેરધારકોને સદર પોર્ટલ બેલેટ નોટિસ પ્રાપ્ત થઈ નથી તેઓ ઉપર ઉલ્લેખિત વેબસાઈટ્સ પરથી તે ડાઉનલોડ કરી શકે છે.

ડિમીટરિયલાઈઝ્ડ મોડમાં શેર ધરાવતા સભ્યો, જેઓએ તેમના ઈ-મેઇલ એડ્રેસ/બેંક ખાતાની વિગતો તેમના ડિપોઝિટરી સહભાગીઓ (ડિપોઝિટરી) સાથે રજીસ્ટર / અપડેટ કરાવ્યાં નથી તેઓને તે તેમના ડિપોઝિટરી સહભાગીઓ સાથે રજીસ્ટર / અપડેટ કરાવવા વિનંતી કરવામાં આવે છે અને ભૌતિક મોડમાં શેર ધરાવતા સભ્યો, જેઓએ કંપની સાથે તેમના ઈ-મેઇલ એડ્રેસ/બેંક ખાતાની વિગતો રજીસ્ટર / અપડેટ કરાવેલ નથી તેઓને કંપનીને ઇલેક્ટ્રોનિક મોડ મારફતે દસ્તાવેજો મોકલવાની સુલભતા માટે તેમનો ફોલીઓ નંબર લખીને અને યોગ્ય રીતે ભરેલ અને દસ્તાસહિત આઈએસઆર-૧ ફોર્મ તથા તેની સાથેના બિડાણો જોડીને [investor.helpdesk@in.mpm.mfui.com](mailto:investor.helpdesk@in.mpm.mfui.com) પર એક ઈ-મેઇલ મોકલીને કંપની સાથે તે નોંધણી / સુધારો કરાવવા વિનંતી કરવામાં આવે છે.

કંપનીએ શેરધારકોને ઇલેક્ટ્રોનિક ભતદાન કરવા સક્ષમ બનાવવા અને રિમોટ ઈ-વોટિંગની સુલભતા માટે સીડીએસએલને નિયુક્ત કરેલ છે. કટ-ઓફ તારીખ સભ્યો (ઓ)ના નામો નોંધાયેલા શેરના પેઈડ-અપ મૂલ્ય પર મતદાનના અધિકારોની ગણતરી કરવામાં આવશે અને કોઈપણ વ્યક્તિ જેઓ એ તારીખ સભ્ય નથી તેમણે આ નોટિસનો ઉપયોગ ફક્ત માહિતીના હેતુ માટે કરવો.

રિમોટ ઈ-વોટિંગ દ્વારા નોટિસમાં દર્શાવેલ વિશેષ વ્યવસાયના વિશેષ ઠરાવ પર મતદાન કરવાની સુવિધા નીચેના સમયગાળા માટે ઉપલબ્ધ રહેશે:

મતદાનનો પ્રારંભ :	શુક્રવાર, ફેબ્રુઆરી ૧૩, ૨૦૨૬ સવારના ૧૦:૦૦ વાગ્યાથી
મતદાનનો અંત :	શનિવાર, માર્ચ ૧૪, ૨૦૨૬ સાંજના ૫:૦૦ વાગ્યા સુધી

ઉપરોક્ત સમય દરમિયાન શુક્રવાર, ફેબ્રુઆરી ૬, ૨૦૨૬ ની કટ-ઓફ તારીખના રોજ જેઓ કંપનીના શેર ભૌતિક સ્વરૂપમાં અથવા ડિમેટ સ્વરૂપમાં ધરાવે છે તેઓ તેમનું મતદાન ઇલેક્ટ્રોનિક રીતે કરી શકશે. શનિવાર, માર્ચ ૧૪, ૨૦૨૬ ના સાંજના ૫:૦૦ વાગ્યા બાદ ઈ-વોટિંગ કરવાની મંજૂરી રહેશે નહીં. ત્યારબાદ મતદાન માટેનું ઈ-વોટિંગ મોડ્યુલ સીડીએસએલ દ્વારા નિષ્ક્રિય બનાવવામાં આવશે.

પોર્ટલ બેલેટ / ઈ-વોટિંગનાં પરિણામો રિમોટ ઈ-વોટિંગના સમાપન બાદથી બે (૨) કાર્યકારી દિવસની અંદર જાહેર કરવામાં આવશે, જે સ્ટેટિસ્ટિકલ અહેવાલની સાથે કંપનીની વેબસાઈટ પર મુકવામાં આવશે અને તેની જાણ સ્ટોક એક્સચેન્જોસને અને સીડીએસએલનાં પણ કરવામાં આવશે.

જો આપને સીડીએસએલ ઈ-વોટિંગ પ્રણાલી દ્વારા ઈ-વોટિંગ સંબંધિત કોઈ પ્રશ્નો કે સમસ્યાઓ છે તો, આપ [helpdesk.evoting@cdsindia.com](mailto:helpdesk.evoting@cdsindia.com) પર ઈ-મેઇલ પાઠવી શકો છો અથવા ૧૮૦૨૧ ૦૯૮ ૧૧ ઉપર સંપર્ક કરી શકો છો.

ઇલેક્ટ્રોનિક માધ્યમથી મતદાનની સુવિધા અંગેના તમામ પ્રશ્નો શ્રી રાકેશ દળવી, એવીપી, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ, "એ" ઓ" વિંગ, રપમો માળ, મેરેશીયન ફ્યુચરેક્સ, મહંતાલાલ મિલ કંપાઉન્ડ્સ, એન.એમ.જોષી માર્ગ, લોઅર પર્વત (પૂર્વ), મુંબઈ- ૪૦૦ ૦૧૩ ને મોકલી શકાશે અથવા [helpdesk.evoting@cdsindia.com](mailto:helpdesk.evoting@cdsindia.com) ને ઈ-મેઇલ મોકલી શકાશે અથવા આ બાબતોમાં ફોન નં.: ૧૮૦૦૨૧ ૦૯૮ ૧૧ ઉપર સંપર્ક કરી શકાશે.

બોર્ડના આદેશથી  
અપાર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વતી,  
સહી / -  
સંજયા કુંદર  
કંપની સેક્રેટરી

સ્થળ : મુંબઈ  
તારીખ : ફેબ્રુઆરી ૧૦, ૨૦૨૬

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ  
ગુજરાત સરકાર

કમિશનર ગ્રામ વિકાસની કચેરી  
ગુજરાત રાજ્ય

# વિકસિત ગ્રામ પંચાયતથી

# વિકસિત ભારત તરફની પહેલ

## વિકસિત ભારત – જી રામ જી

## ૧૨૫ દિવસ

## ગ્રામીણ રોજગારીની

## નવી ગેરંટી

બેરોજગારી ભથ્થા માટે  
યોગ્ય જોગવાઈ

સમયસર પેતનની ચૂકવણી  
અને વિલંબ માટે વળતર

ગ્રામસભા દ્વારા વિકસિત  
ગ્રામ પંચાયત યોજના (VGPP)

વિકસિત ભારત - જી રામ જી યોજનામાં ૧૨૫ દિવસ રોજગારીની ગેરંટી ગ્રામીણ પરિવારો માટે આજીવિકાનો મજબૂત આધાર અને મુશ્કેલ સમયમાં આશાનું કિરણ સાબિત થશે.

- શ્રી હર્ષ સંઘવી  
માન. નાયબ મુખ્યમંત્રી, ગુજરાત